

NF-133

November-2018

LL.B., Sem.-V

303 : Evidence Act

Time : 2:30 Hours]

[Max. Marks : 100

સૂચના : જમણી બાજુનાં અંક કુલ ગુણ દર્શાવે છે.

1. પુરાવાની વ્યાખ્યા આપી, તેનાં પ્રકારોની નિર્ણિત કેસો સહિત સમજૂતી આપો. 25
અથવા
"પુરાવા અધિનિયમ દીવાની અને ફોજદારી કાર્યવાહીમાં સમાન છે." આ વિધાનની તેનાં અપવાદો અને કેસ-લો સહિત ચર્ચા કરો.
2. પુરાવા અધિનિયમ અન્વયે "કબુલાત"ની જોગવાઈઓની વિવિધ નિર્ણિત કેસો સાથે સમજૂતી આપો. 25
અથવા
પુરાવા અધિનિયમ હેઠળ સાબિતીનાં બોજા અંગેની જોગવાઈઓની ઉચિત કેસો સહિત ચર્ચા કરો.
3. નિર્ણિત કેસોની મદદથી સહઆરોપીની જુબાનીનાં પુરાવાકીય મુદ્દ્યની ચર્ચા કરો. 25
અથવા
પુરાવા અધિનિયમ અન્વયે સ્વીકૃતિનાં પ્રબંધોની કેસ લો સાથે વિગતે સમજૂતી આપો.
4. (A) નીચેના પૈકી ગમે તે એક વિગતે સમજાવો : 15
(1) મરણોન્મુખ નિવેદન અને તેનું પુરાવાકીય મુદ્દ્ય
(2) વિશેષાધિકૃત સંવહનો અંગેનાં પ્રબંધો
(B) નીચેનાં વિધાનો ખરા છે કે ખોટા તે કારણો સહિત જણાવો : 10
(1) નકશો અથવા પ્લાન એ દસ્તાવેજી પુરાવો નથી.
(2) પતિ-પત્ની વચ્ચે તેમનાં લગ્નજીવન દરમિયાન જે કોઈ સંવહનો થયા હોય તે તમામ વિશેષાધિકૃત સંવહનો ગણાશે.
(3) નોટરી પબ્લિક દ્વારા નોટરાઈઝ કરેલ લેખ પુરાવામાં ગ્રાહ્ય છે.
(4) નિષ્ણાંત વ્યક્તિનો પુરાવો એ પુરાવા તરીકે ગ્રાહ્ય છે.
(5) અદાલતને ન્યાયિક નોંધ લેવાની સત્તા છે.

Seat No. : _____

NF-133

November-2018

LL.B., Sem.-V

303 : Evidence Act

Time : 2:30 Hours]

[Max. Marks : 100

Instruction : Figures to the right side indicate full marks.

1. Define and explain briefly the term "Evidence" and its kinds with the decided cases. **25**

OR

"The Evidence Act is common in civil and criminal proceedings." Discuss this statement with its exceptions and case laws.

2. Explain in detail the provisions relating to "Confession" with decided cases. **25**

OR

Discuss the provisions of "Burden of Proof" with the relevant cases.

3. Discuss in detail the evidential value of "Accomplice" with the help of decided cases. **25**

OR

Explain in detail the provisions relating to "Admission" under the Evidence Act.

4. (A) Explain in detail any **one** from the following : **15**

- (1) Dying Declaration and its evidential values.
- (2) Provisions relating to Privileged Communications.

- (B) State with reasons whether the following statements are true or false : **10**

- (1) A map or plan is not a Documentary Evidence.
- (2) All the communications made between Husband and Wife during their Marriage Life are Privileged Communications.
- (3) Documents notarized by a Notary Public are admissible as evidence.
- (4) Evidence of Expert is admissible as evidence.
- (5) Court has power to take the Judicial Notice.